

**M.A. (ECONOMICS) Semester - 1 (CBCS) Examination
OCT/NOV-2025 (AS PER SYLLABUS YEAR JUNE-2018)
MACRO ECONOMICS - 1(CORE)**

Time: 2:30 Hours**Marks: 70****Instructions:**

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

પ્રશ્ન.૧	રાષ્ટ્રીય આવકના સામાજિક હિસાબો સમજાવો.	(૧૪)
	અથવા	
પ્રશ્ન.૧	રાષ્ટ્રીય આવક નિર્ધારણ (રોજગારી નિર્ધારણ) અંગેનો કેઇન્સનો અભિગમ સમજાવો.	
પ્રશ્ન.૨	ફિશરનો નાણાં પરિમાણનો સિદ્ધાંત સમજાવો.	(૧૪)
	અથવા	
પ્રશ્ન.૨	કેઇન્સનો તરલતા પસંદગીનો સિદ્ધાંત સમજાવો.	
પ્રશ્ન.૩	મૂડીરોકાણનો અર્થ અને તેના નિર્ધારક પરિબલો સમજાવો.	(૧૪)
	અથવા	
પ્રશ્ન.૩	ગુણકનો ખ્યાલ સવિસ્તારથી સમજાવો.	
પ્રશ્ન.૪	નાણાંના પુરવઠા અંગે RBIનો અભિગમ સમજાવો.	(૧૪)
	અથવા	
પ્રશ્ન.૪	નાણાં બજારનો અર્થ અને તેના મુખ્ય સાધનો (ઘટકો) સમજાવો.	
પ્રશ્ન.૫	ટ્રેક નોંધ લખો (કોઈ પણ બે)	(૧૪)
	(1) રાષ્ટ્રીય આવક માપવાની પદ્ધતિઓ	
	(2) મિલ્ટન ફ્રીડમેનનો નાણાં પરિમાણનો સિદ્ધાંત	
	(3) મૂડીની સીમાંત કાર્યક્ષમતા અને મૂડીરોકાણ	
	(4) મોડીગ્લીનીનાનો નાણાંની માંગનો અભિગમ	

ENGLISH VERSION

Que.1	State the Social Accounts of National Income.	(14)
	OR	
Que.1	Explain Keynes' approach to national income determination (employment determination)	
Que.2	Explain Fisher's quantity theory of money.	(14)
	OR	
Que.2	Explain Keynes' theory of liquidity preference.	
Que.3	Explain the meaning of investment and its determinants.	(14)
	OR	
Que.3	Explain the concept of multiplier in detail.	
Que.4	Explain RBI's approach to money supply.	(14)
	OR	
Que.4	Explain the meaning of money market and its main instruments (components).	
Que.5	Write Short note (Any Two)	(14)
	(1) Methods of measuring national income	
	(2) Milton Friedman's quantity theory of money	
	(3) Marginal efficiency of capital and investment	
	(4) Modigliani's approach to money demand	
